

Tatva Chintan Pharma Chem Limited

(Formerly known as Tatva Chintan Pharma Chem Private Limited) (CIN:U24232GJ1996PLC029894)



Date:-8 September 2021 Ref No:-TCPCL/SEC/2021-22/00016

To.

The General Manager,

Corporate relationship department,

BSE Limited

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street, Fort.

Mumbai-400 001

Scrip Code: 543321

Through: BSE Corporate Compliance & Listing Centre

The Manager,

Listing department,

National Stock Exchange of India

Limited

Exchange Plaza, C-1, Block-G,

Bandra-Kurla, Complex Bandra(E),

Mumbai-400 051

Scrip Symbol: TATVA

Through: NEAPS

Dear Sir/Madam,

Sub:-Newspaper publication regarding e-voting information for 25th Annual General Meeting

Pursuant to section 108 of the Companies Act, 2013 r.w. rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and the Secretarial Standards on general meetings issued by the Institute of Company Secretaries of India and pursuant to Regulation 30 and Regulation 47 r.w. Schedule III Para A Clause 12 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, please find enclosed herewith the copies of newspaper advertisement published in Financial Express (English) and Vadodara Samachar (Gujarati) on 8 September 2021, intimating e-voting information w.r.t. 25th Annual General Meeting of the Company that will held on 29 September 2021 at 4:00 p.m. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM").

Members holding equity shares either in physical form or dematerialized form, as on the cut- off date 22 September 2021 may cast their vote electronically on the business as set forth in the notice of the 25th AGM through the electronic voting system of Link Intime India Private Limited https://instavote.linkintime.co.in (agency appointed for providing the Remote e-Voting facility)

All the members are hereby informed that:

- a) The Business as set forth in the notice of the 25th AGM shall be transacted through remote e-voting and e-voting during the AGM;
- b) The remote e-voting shall commence on 26 September 2021 at 9:00 a.m.(IST);
- c) The remote e-voting shall close on 28 September, 2021 at 5:00 p.m. (IST);
- d) The cut off date for determining the eligibility to vote by remote e-voting and/or e-voting during the AGM shall be 22 September 2021.
- e) Any person, who acquire equity shares of the Company and becomes a member of the Company after dispatch of the notice of the AGM may obtain the Login ID and password as per the Instructions given in the note no 25 of the notice of AGM.
- f) Members may note that:
 - I. The remote e-voting shall be disabled beyond 5:00 p.m. (IST) on 28 September 2021 and once the vote on resolution is cast and confirmed by the member shall not be allowed to change it subsequently;
 - II. The facility for e-voting will also be made available during the AGM and those members present at the AGM through VC/OAVM facility, who have not cast their vote on resolution through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system at the AGM. The

Factory and Registered Office: Plot No. 502/17, G.I.D.C. Estate, Ankleshwar - 393 002, District: Bharuch, Gujarat, India. SEZ Unit: Plot No. Z/103/F/1 and Plot No. Z/103/F/2, SEZ Area Part-2, Dahej - 392 130, District: Bharuch, Gujarat, India.

DSIR Approved R & D Centre: Plot No. 353, G.I.D.C., Makarpura, Vadodara - 390 010, Gujarat, India.

Telephone No: +91 75748 48533 / 34 Fax: +91 265 263 8533

E-mail: chintan@tatvachintan.com Website: www.tatvachintan.com



Tatva Chintan Pharma Chem Limited

(Formerly known as Tatva Chintan Pharma Chem Private Limited) (CIN:U24232GJ1996PLC029894)



detailed procedure for voting during the AGM is set out in the notice at Note no 25 of Instruction part of the notice.

- III. The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also join the AGM through VC but shall not be entitled to cast their vote again;
- IV. A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. 22 September 2021 only shall be entitled to cast their vote either through remote e-voting or through e-voting at the AGM;
- V. Members may note that the said Notice and Annual Report are available on the Company's website www.tatvachintan.com, website of the Stock Exchanges i.e BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of Link Intime India Private Limited https://linkintime.co.in an agency appointed for conducting Remote e-voting during the AGM.
- VI. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rajiv Ranjan (AVP), Linkintime or send an email to enotice@linkintime.co.in. or rnt@linkintime.co.in or call on Tel: 022-49186000.

Helpdesk for Individual Shareholders holding securities in demat mode:

In case shareholders/ members holding securities in demat mode have any technical issues related to login through Depository i.e. NSDL/ CDSL, they may contact the respective helpdesk given below:

Login Type	Helpdesk details	
Individual Shareholders holding securities in demat mode with NSDL	Members facing any technical issue in login can contact NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30	
Individual Shareholders holding securities in demat mode with CDSL	Members facing any technical issue in login can contact CDSL helpdesk by sending a request at helpdesk.evoting@cdslindia.com or contact at 022-23058738 or 22-23058542-43.	

Helpdesk for Individual Shareholders holding securities in physical mode/ Institutional shareholders & evoting service provider is LINKINTIME:

In case shareholders/ members holding securities in physical mode/ Institutional shareholders have any queries regarding e-voting, they may refer the Frequently Asked Questions('FAQs') and InstaVote e-Voting manual available at https://instavote.linkintime.co.in, under Help section or send an email to enotices@linkintime.co.in or contact on: - Tel: 022 – 4918 6000.

Kindly take the above disclosure on your records.

Thanking You,

Your faithfully,

For Tatva Chintan Pharma Chem Limited





Apurva Dubey

Company Secretary and Compliance Officer

Membership no: A41130

Factory and Registered Office: Plot No. 502/17, G.I.D.C. Estate, Ankleshwar - 393 002, District: Bharuch, Gujarat, India. SEZ Unit: Plot No. Z/103/F/1 and Plot No. Z/103/F/2, SEZ Area Part-2, Dahej - 392 130, District: Bharuch, Gujarat, India.

DSIR Approved R & D Centre: Plot No. 353, G.I.D.C., Makarpura, Vadodara - 390 010, Gujarat, India.

Telephone No: +91 75748 48533 / 34 Fax: +91 265 263 8533

E-mail: chintan@tatvachintan.com Website: www.tatvachintan.com

FINANCIAL EXPRESS

HIND SECURITIES & CREDITS LIMITED Registered & Corporate Office:D-16, Ground Floor, Udyog Nagar, Nangloi, Delhi - 110041 CIN: L74899DL1993PLC056702: Phone No:91-9899425575:

e-mail address: supersecurities1993@gmail.com; Website: www.supersecurities.in INTIMATION REGARDING COMPLETION OF DISPATCH OF NOTICE OF 28TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

Notice is hereby given that the 28"Annual General Meeting ("AGM") of the Members of Hind Securities & Credits Limited will be held on Thursday, September 30, 2021 at 11:00a.m.through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") to transact the ordinary businesses as stated in the Notice convening the AGM. As per the various Circular issued by MCA, theNotice of the AGM together with the Annual Report of the Company for the Financial Year 2020-21 has been sent to the Members of the Company by e-mail to their registered e-mail addresses. The Company has completed the mailing of Notice convening the AGM alongwith the aforesaid Annual Report on September 7, 2021.

The Members, who have not registered their e-mail addresses so far, are requested to register their e-mail addresses with their concerned Depository Participant (in respect of shares held in demat form) or with Link In time India Private Limited, Registrar & Share Transfer Agent (RTA) of the Company (in respect of shares held in physical form).

Members are hereby informed that the notice of the 28"AGM and the Annual Report of the Company are also available on the Company's website (www.supersecurities.in). Notice of AGM is also available on the e-voting website of National Securities Depository Limited (NSDL)at

Members are also informed that pursuant to Section 108 of the Companies Act, 2013("the Act") read with the relevant rules made thereunder, as amended from time to time, the Company is providing remote e-voting (prior to the AGM) and e-voting during AGM to its members to cast their votes electronically on the resolutions to be passed at the 28"AGM. The Members are further informed that the cut-off date for the purpose of ascertaining the members eligible for e-voting facility has been fixed as Thursday, September 23, 2021. Aperson, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during AGM.

The Members are requested to note that remote e-voting process shall commence on Monday, September 27, 2021 at 9:00 a.m. and will remain open upto Wednesday. September 29, 2021 till5:00 p.m. Thereafter, the remote e-voting module shall be disabled by NSDL. Once the vote on a resolution is cast by a Member, he / she / it shall not be allowed to change it subsequently. The Members who have not cast their vote through remote e-voting can exercise their voting rights electronically during AGM. The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend the AGM, but shall not be entitled to cast their vote again during AGM The Company has appointed Mr. Chetan Gupta (Membership No. FCS-6496 & CP No. 7077), PracticingCompany Secretary, as the scrutinizer to scrutinize the e-voting process in a fair and

The detailed procedure/ instructions for remote e-voting, attending AGM and e-voting during

AGM are contained in the Notice of 28" AGM. The remote e-voting facility is available to the Members to cast their votes at the e-voting website of NSDL: www.evoting.nsdl.comor the Member may refer Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders, available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request at evoting@nsdl.co.in..

Any query or grievance in relation to e-voting may be addressed to Ms. Priyanka Sethi, Company Secretary, e-mail address:supersecurities1993@gmail.com, Address: D-16, Ground Floor, Udyog Nagar, Nangloi, Delhi - 110041, Contact No.:91-9899425575.

Any person who becomes a Member after sending the Notice and Annual Report through e-mail but who holds shares as on cut-off date can attend the AGM through VC / OAVM. Such Member can exercise his voting right through remote e-voting or e-voting during AGM and send a requisition for a copy of the Annual Report and Notice convening the AGM through e-mail communication to RTA at delhilinkintime.co.in with a copy marked to the Company at alongwith his / her / its relevant particulars i.e. DP ID& Client ID / Folio No. to obtain User Id and Password for e-voting. If shareholder is individual shareholder and hold shares in demat mode he/she can generate password as explain in e-voting instruction.

Since the 28" AGM will be held pursuant to the aforesaid Circulars through VC / OAVM, physical attendance of Members has been dispensed with. Accordingly, the facility for appointment of proxies by the Members will not be available

Notice is also hereby given that pursuant to the provisions of Section 91 of the Act, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Friday, September 24, 2021 to Thursday, September 30, 2021 (both days inclusive) for the purpose of 28"

By order of the Board of Directors For Hind Securities & Credits Limited (Priyanka Sethi) Company Secretary

Membership No.: A32756

Place : Delhi



TATVA CHINTAN PHARMA CHEM LIMITED

Bharuch GJ 393002 IN. Phone: +91 7574848533/34, Fax: +91 265 263 8533

PUBLIC NOTICE REGARDING THE 25[™] ANNUAL GENERAL MEETING (AGM) TO BE HELD THROUGH VIDEO CONFERENCE ("VC")/ OTHER AUDIO VISUAL MEANS ("OAVM") AND E-VOTING INFORMATION

Chintan Pharma Chem Limited ("the Company") will be held on Wednesday, 29 September 2021 at 4:00 p.m. (IST) through Video Conference ("VC")/ Other Audio Visual Means ("OAVM") in compliance with all circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and issued by Securities and Exchange Board of India (hereinafter collectively referred to as circulars).

In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the

Members holding equity shares either in physical form or dematerialized form, as on the cut- off date 22 September 2021 may cast their vote electronically on the business as set forth in the notice of the 25th AGM through the electronic voting system of Link Intime India Private Limited https://instavote.linkintime.co.in (agency appointed for providing the Remote e-Voting facility)

All the members are hereby informed that: a) The Business as set forth in the notice of the 25" AGM shall be transacted

through remote e-voting and e-voting during the AGM;

d) The cut-off date for determining the eligibility to vote by remote e-voting

e) Any person, who acquire equity shares of the Company and becomes a

member of the Company after dispatch of the notice of the AGM may obtain the Login ID and password as per the Instructions given in the note no. 25 of the notice of AGM.

I. The remote e-voting shall be disabled beyond 5:00 p.m. (IST) on 28 September 2021 and once the vote on resolution is cast and confirmed by the member shall not be allowed to change it subsequently;

II. The facility for e-voting will also be made available during the AGM and those members present at the AGM through VC/OAVM facility, who have not cast their vote on resolution through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system at the AGM. The detailed procedure for voting during the AGM is set out in the notice at note no. 25 of Instruction part of the notice.

III. The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also join the AGM through VC but shall not be entitled to cast

IV. A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. 22 September 2021 only shall be entitled to cast their vote either through remote e-voting or through e-voting at the AGM;

V. Members may note that the said Notice and Annual Report are available on the Company's website www.tatvachintan.com, website of the Stock Exchanges i.e BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of Link Intime India Private Limited https://linkintime.co.in an agency appointed for conducting Remote evoting during the AGM.

VI. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rajiv Ranjan (AVP), Link intime or send an email to enotice@linkintime.co.in. or rnt@linkintime.co.in or call on Tel: 022-49186000.

Helpdesk for Individual Shareholders holding securities in demat mode:

In case shareholders/ members holding securities in demat mode have any contact the respective helpdesk given below:

Login Type	neipaesk aetalis		
Individual Shareholders holding securities in demat mode with NSDL	Members facing any technical issue in login can contact NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30		
Individual Shareholders holding securities in demat mode with CDSL	Members facing any technical issue in login can contact CDSL helpdesk by sending a request at helpdesk.evoting@cdslindia.com or contact at 022, 23058738 or 22, 23058542, 43		

In case shareholders/ members holding securities in physical mode/ Institutional shareholders have any queries regarding e-voting, they may refer the Frequently Asked Questions ('FAQs') and InstaVote e-Voting manual available at

Companies Act, 2013 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from 15 September 2021 to 29 September 2021 (Both days inclusive) for the purpose of 25" AGM.

Apurva Dubey Company Secretary and Compliance Officer

ASSAM ENTRADE LIMITED

Regd off: 16 TARA CHAND DUTTA STREET, 2ND FLOOR, KOLKATA-700073 CIN: L20219WB1985PLC096557 ;website: www.assamentrade.com Email: assamentrade1985@gmail.com; telephone no: 033-22343520

NOTICE TO MEMBERS OF 36th ANNUAL GENERAL MEETING THROUGH VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM), REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

This is in continuation to our earlier communication dated 05/09/2021, whereby Members of Assam Entrade Limited ("the Company") were informed that in compliance with the provisions of the Companies Act, 2013 and Rules framed thereunder and the SEBI (LODR) Regulations, 2015 read with general circular Nos. 14/2020, 17/2020, 20/2020 and 02/2021 dated April 08,2020, April 13, 2020 ,May 05, 2020 and January 13, 2021 respectively issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 issued by the SEBI, it was decided to convene the 36th AGM of the Company on Thursday, 30th September, 2021 at 02:30 p.m. through Video Conferencing/Other Audio Visual Means ('OAVM') facility, without the physical presence of the Members at a common venue, to transact the business as set out in the Notice of 36th AGM.

The Notice of 36th AGM and Annual Report of the Company for the FY 2020-2021 along with login details for e-voting has been sent on 7th September, 2021 through email to all those members whose email id was registered with the Company or the Registrar and Share Transfer Agent or with their respective Depository Participant ("DP") in accordance with the above MCA circulars and SEBI Circulars, and the same are also available on Company's website (www.assamentrade.com), BSE website(www.bseindia.com) and on the website of NSDL(at www.evoting.nsdl.com). In compliance with the provisions of Section 108, of Companies Act, 2013 and rules

framed thereunder, Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, Secretarial Standard-2 issued by ICSI and MCA Circulars, the Members are provided with the facility to cast their votes electronically through remote e-voting (prior to e voting) and e-voting (during the AGM) services provided by NSDL on all resolutions set forth in the Notice of The remote e-voting shall commence on 27th September, 2021(at 09:00a.m.) and ends on

29th September, 2021 (at 05:00 p.m.). During this period, members may cast their votes electronically. Thereafter, the remote e voting module shall be disabled by NSDL for

The Members who will have cast their votes by remote e-voting prior to the AGM may also participate in the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their votes again through e voting facility available during AGM.

Once the Members cast vote on a resolution, they shall not be allowed to change it subsequently. Detailed instructions of remote e voting, joining the AGM, and e-voting during AGM are provided in the Notice of 36th AGM.

CS Saket Sharma, Practicing Company Secretary (Mem no: 4229; COP: 2565), has been appointed as Scrutinizer by the Company to scrutinize the entire e voting process in a fair and transparent manner. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid up equity share capital of the Company as on 23rd September, 2021("cut off date"). A person, whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut off date shall only be entitled to join the AGM, avail the remote e voting and e voting facility during the AGM. A person who ceases to be a Member as on cut off date should treat this Notice for information purpose only.

Any person, who acquires shares and becomes a Member of the Company after the date of electronic dispatch of the Notice of 36th AGM and holding shares as on the Cut off date, may obtain the Login ID and password by following the instructions as mentioned in the Notice of 36th AGM or sending a request to e voting @nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote e voting, then he/she can use his/her existing User ID and password to cast their vote.

If you have not registered your email address with the Company/DP, you may please follow the below instructions for obtaining details for e voting:

Physical Holding	Please provide necessary details like Folio No., name of Shareholders, scanned copy of the share certificate (front and back), self attested scanned copy of PAN card, self-attested scanned copy of Aadhar Card or any other document as proof of address by email to Company/RTA email id.
Demat Holding	Please provide DEMAT account details (CDSL-16 digit beneficiary ID) or (NSDL- 16 Digit DPID +CLID), Name, client master or copy of Consolidated Account statement, self-attested scanned copy of Aadhar Card or any other document as proof of address to Company/RTAemail ID.

Further, pursuant to the provisions of Section 91 of Companies Act, 2013 and Rules ramed thereunder and Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday 24th September, 2021 till Thursday, 30th September, 2021 (both days inclusive) for the purpose The result of e voting shall be declared within 48 hours from the conclusion of AGM i.e on or

before 02nd October, 2021 and results so declared along with the consolidated Scrutinizer's Report will be placed on the Company's website (www.assamentrade.com) and NSDL website (www.evoting.nsdl.com). In case of any queries or issues, you may refer the frequently asked questions and e voting

nanual available at https://www.nsdl.co.in/fags/fag.php or write an email at evoting@nsdl.co.in. For Assam Entrade Limited

Place: Kanpur Date : 08.09.2021

Sd/- (Shalini Agarwal) (Company Secretary/Compliance Officer)

ROYAL CUSHION VINYL PRODUCTS LIMITED

CIN NO: L24110MH1983PLC031395 "Shlok" 60 - CD, Govt. Industrial Estate, Charkop, Kandivali (W), Mumbai - 400 067 Tel: + 91 22 28603514, 16 Website: www.rcvp.in; Email id:-legalho83@gmail.com NOTICE

Notice is hereby given that the 37th (Thirty Seventh) Annual General Meeting ("AGM") of Royal Cushion Vinyl Products Limited ("the Company") will be held through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") on Thursday 30" September, 2021 to transact the businesses as mentioned in the Notice convening the said meeting which is emailed to the members of the Company.

The Annual Report for the financial year 2020-21 of which notice of the 37th AGM is a part have been sent in electronic mode to members whose email-ids are registered with the Company or Depository Participant(s). The requirements of sending physical copy of the Notice of the AGM and Annual Report to the Members have been dispensed with vide MCA circular/s and SEBI circular. The Notice of the 37th Annual General Meeting which is a part of the Company's Annual Report is uploaded on the website of the Company at www.rcvp.in.

The Annual Report for the financial year 2020-21 of which the Notice of 37th AGM is a part is also available on the Company's website www.rcvp.in. Members who have not received the Annual report may download it from the Company's website or may request for an electronic copy of the same by writing to the company at the above mention email id.

Notice is further given pursuant to Section 91 of the Companies Act, 2013 that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from 24th September, 2021 to 30th September, 2021 both days inclusive for the purpose of AGM.

Pursuant to the provision of Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) rules, 2014 as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 the Company is pleased to provide its member with the facility to exercise their vote on the agenda items as stated in the notice of the Annual General Meeting by electronic means and the business may be transacted through the e-voting services provided by National Securities Depository Services Limited (NSDL).

The details pursuant to the provisions of section 108 of the Companies Act, 2013 and the relevant Rules prescribed thereunder as follows: 1. The business may be transacted through voting by electronic means

Date and time of commencement of remote e-voting: Monday 27th September, 2021 (9.00 a.m.)

Date and time of end of remote e-voting: Wednesday 29th September 2021 (5.00 p.m.)

Cut off date: Thursday, 23rd September 2021.

5. Any person, who acquires shares of the Company and has become member of the Company after dispatch of notice and holding shares as of the cut-off date i.e. 23rd September, 2021 may obtain the login ID and password by sending an email to evoting @nsdl.co.in or Company/ Registrars by mentioning his Folio No./DP ID and Client ID no. However, if any member is already registered with NSDL for remote e-voting, then he can use his existing User Id and Password for casting his vote. If he forgets his password, he can reset password by using "Forgot User Details/Password" or "Physical User/Reset Password" option available on www.evoting.nsdl.com or contact NSDL at the following Toll Free no. 1800222990.

6. E-voting by electronic mode shall not be allowed beyond 5.00 p.m. on 29th September, 2021.

The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM thru VC/OAVM but shall not be entitled to cast their vote again.

Members of the Company holding shares either in physical form or in dematerialised form as on the cut- off date of 23rd September, 2021 only shall be entitled to avail the facility of remote e-voting as well as the Annual General Meeting. The voting rights of the members shall be in proportion to their shares of the paid-up equity share capital of the Company.

The Company is also providing remote e-voting facility to its members in respect of the business to be transacted during the 37th AGM Members may follow the same procedure for e-voting during the 37th AGM as mentioned above for remote e-voting. Only those Members, who will present in the 37th AGM through VC/OAVM Facility and have not cast their vote on the Resolutions through remote e-voting shall be eligible to vote through e-voting system in the 37th AGM.

of the 37th AGM is a part is also available on the Company's website www.rcvp.in and on the website of National Securities Depository Services Ltd.(NSDL) www.evoting.nsdl.com. 11. The Shareholders may contact the undersigned for any grievances

connected with electronic voting.

Dated: September 07, 2021

10. The Annual Report for the financial year 2020-21 of which the Notice

Mrs. Deepti Parekh, Company Secretary Royal Cushion Vinyl Products Limited "Shlok" 60 - CD, Govt. Industrial Estate, Charkop, Kandivali (W), Mumbai – 400 067; Email:legalho83@gmail.com Tel no:022-28603514.

> By order of the Board of Directors for Royal Cushion Vinyl Products Limited

Deepti Parekh Company Secretary



Place: Noida

Date: 7" September, 2021

RACL Geartech Limited

CIN: L34300DL1983PLC016136 Regd. Office: 15th Floor, Eros Corporate Tower, Nehru Place, New Delhi - 110019

Phones: +91-11-66155129, +91-120-4588500 Fax No.: +91-120-4588513 | E-Mail: investor@raclgeartech.com Website: www.raclgeartech.com

NOTICE is hereby given that following share certificate(s) issued by the Company are stated to be lost/ misplaced and the registered holder thereof have applied to the Company for issue of duplicate share certificates:

Folio No.	Name of the Shareholder	Share Certificate(s) No.	Distinctive Numbers		No. of Shares
	a :s		From	To	
0013143	Bipin R Mehta	22180-81	4817008	4817207	200

above share certificates. Any person(s) who has/ have any claim(s) with the Company in respect of the said share certificates should lodge such claim at its Registered Office at the address given above within 15 days of the publication of this Notice, after which no claim will be entertained and the Company will proceed to issue Duplicate Share Certificates.

Shagun Bajpai

NOTICE FOR THE LOSS OF SHARE CERTIFICATES

olio No.	Name of the Shareholder	Share Certificate(s) No.	Distinctive Numbers		No. of Shares	
			From	To		
013143	Bipin R Mehta	22180-81	4817008	4817207	200	
e public i	s hereby warne	d against purchasin	g or deali	ng in any v	vay with the	

For RACL Geartech Limited

Company Secretary & Compliance Officer

ASHOKA MARKETING LIMITED (CIN: U74899DL1948PLC005771)

Regd. Office: First Floor, Express Building, 9-10, Bahadur Shah Zafar Marg, New Delhi-110002 Email: ashokamarketing1@gmail.com, Phone No.: 011-43540801

PUBLIC NOTICE FOR PROPOSED CHANGE OF MANAGEMENT

In compliance with the Para 5 of Notification No. DNBS. (PD) 029/CGM (CDS)-2015 issued by Reserve Bank of India on July 09, 2015, Notice is hereby given that M/s. Ashoka Marketing Limited, a company incorporated under the provisions of the Companies Act, 1913 and having its Registered Office at First Floor, Express Building, 9-10, Bahadur Shah Zafar Marg, New Delhi-110002 and registered with the Reserve Bank of India vide Certificate Number 14.01778 as a Non Deposit taking NBFC (hereinafter referred to as "the Company") hereby propose the change in the management of the company by appointing Mr. Ramesh Sengal as an Additional Director on the Board of the Company. The company has already obtained the prior approval for change of Management from RBI, Delhi vide letter No. 272 /CMS-IV/05.01.212/2021-22 dated September 6, 2021. The proposed move is aimed to broad base the existing Board. Any clarification / Objection in this regard may be addressed to Department of Non-Banking

Supervision, Reserve Bank of India, 6, Sansad Marg, Delhi-110001 within 30 days from the date of publication of this notice stating therein the nature of interest and grounds of objection. For Ashoka Marketing Limited

NAV as on 06-09-2021 (per unit)

Sukanta Kumar Mohanty Dated: 07/09/2021 Chief Financial Officer Place: New Delhi

MUTUALFUNDS Haq, ek behtar zindagi ka.

Notice - Income Distribution Cum Capital Withdrawal

Sr. No.	Scheme Name	Option/Plan	Proposed Gross IDCW per unit (₹)	Nav p Unit (
1	UTI - Fixed Income Interval Fund - Quarterly Interval Plan I	Retail Direct Plan - IDCW Option	0.0765	10.089
2	UTI - Fixed Income Interval Fund - Quarterly Interval Plan I	Retail Existing Plan - IDCW Option	0.0715	10.081
3	UTI - Fixed Income Interval Fund -Annual Interval Plan I	Retail Existing Plan - IDCW Option	0.0746	10.085
4	UTI - Fixed Income Interval Fund- Annual Interval Plan II	Retail Direct Plan - IDCW Option	0.0774	10.090
5	UTI - Fixed Income Interval Fund -Annual Interval Plan II	Retail Existing Plan - IDCW Option	0.0749	10.085
6	UTI - Fixed Income Interval Fund- Quarterly Interval Plan III	Retail Direct Plan - IDCW Option	0.0798	10.09
7	UTI - Fixed Income Interval Fund -Quarterly Interval Plan III	Retail Existing Plan - IDCW Option	0.0743	10.084
8	UTI - Fixed Income Interval Fund- Annual Interval Plan III	Retail Direct Plan - IDCW Option	0.0722	10.09
9	UTI - Fixed Income Interval Fund -Annual Interval Plan III	Retail Existing Plan - IDCW Option	0.0692	10.08
10	UTI - Fixed Income Interval Fund -Annual Interval Plan IV	Retail Direct Plan - IDCW Option	0.0769	10.08
11	UTI - Fixed Income Interval Fund- Annual Interval Plan IV	Retail Existing Plan - IDCW Option	0.0744	10.088
12	UTI - Fixed Income Interval Fund- Half Yearly Plan I	Retail Direct Plan - IDCW Option	0.0696	10.079
13	UTI - Fixed Income Interval Fund- Half Yearly Plan I	Retail Existing Plan - IDCW Option	0.0540	10.06
14	UTI - Fixed Income Interval Fund -Half Yearly Plan II	Retail Direct Plan - IDCW Option	0.0918	10.24
15	UTI - Fixed Income Interval Fund - Half Yearly Plan II	Retail Existing Plan - IDCW Option	0.0605	10.069
16	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan IV	Retail Direct Plan - IDCW Option	0.0709	10.08
17	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan IV	Retail Existing Plan - IDCW Option	0.0660	10.075
18	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan V	Retail Direct Plan - IDCW Option	0.0830	10.09
19	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan V	Retail Existing Plan - IDCW Option	0.0714	10.08
20	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan VI	Retail Direct Plan - IDCW Option	0.0773	10.088
21	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan VI	Retail Existing Plan - IDCW Option	0.0724	10.08
22	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan VII	Retail Direct Plan - IDCW Option	0.0594	10.06
23	UTI - Fixed Term Income Fund - Sr-2 Quarterly Interval Plan VII	Retail Existing Plan - IDCW Option	0.0545	10.06
24	UTI - Fixed Term Income Fund Series XXX-IV (1125 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1612	10.00
				10.22
25	UTI - Fixed Term Income Fund Series XXX-IV (1125 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1529	
26	UTI - Fixed Term Income Fund Series XXX-V (1135 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1598	10.30
27	UTI - Fixed Term Income Fund Series XXX-VI (1107 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1052	10.13
28	UTI - Fixed Term Income Fund Series XXX-VI (1107 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1096	10.12
29	UTI - Fixed Term Income Fund Series XXX-IX (1266 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1884	10.21
30	UTI - Fixed Term Income Fund Series XXX-IX (1266 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1796	10.20
31	UTI - Fixed Term Income Fund Series XXX-X (1267 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2009	10.464
32	UTI - Fixed Term Income Fund Series XXX-X (1267 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1943	10.450
33	UTI - Fixed Term Income Fund Series XXX-XI (1246 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2079	10.33
34	UTI - Fixed Term Income Fund Series XXX-XI (1246 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1974	10.34
35	UTI - Fixed Term Income Fund Series XXX-XII (1254 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1964	10.43
36	UTI - Fixed Term Income Fund Series XXX-XIII (1224 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1982	10.319
37	UTI - Fixed Term Income Fund Series XXX-XIV (1209 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2099	10.36
38	UTI - Fixed Term Income Fund Series XXX-XIV (1209 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1957	10.41
39	UTI - Fixed Term Income Fund Series XXX-XV (1223 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1969	10.38
40	UTI - Fixed Term Income Fund Series XXXI-I (1209 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2045	10.35
41	UTI - Fixed Term Income Fund Series XXXI-I (1209 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1950	10.349
42	UTI - Fixed Term Income Fund Series XXXI-II (1222 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2108	10.428
43	UTI - Fixed Term Income Fund Series XXXI-II (1222 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1991	10.415
44	UTI - Fixed Term Income Fund Series XXXI-III (1174 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1988	10.366
45	UTI - Fixed Term Income Fund Series XXXI-III (1174 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1883	10.400
46	UTI - Fixed Term Income Fund Series XXXI-IV (1204 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2046	10.50
47	UTI - Fixed Term Income Fund Series XXXI-IV (1204 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1984	10.450
48	UTI - Fixed Term Income Fund Series XXXI-V (1174 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2052	10.54
49	UTI - Fixed Term Income Fund Series XXXI-V (1174 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1955	10.530
50	UTI - Fixed Term Income Fund Series XXXI-VI (1167 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.2008	10.35
51	UTI - Fixed Term Income Fund Series XXXI-VI (1167 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1935	10.34
52	UTI - Fixed Term Income Fund Series XXXI-VII (1155 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1890	10.49
53	UTI - Fixed Term Income Fund Series XXXI-VII (1155 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1800	10.48
54	UTI - Fixed Term Income Fund Series XXXI-VIII (1153 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1949	10.36
55	UTI - Fixed Term Income Fund Series XXXI-VIII (1153 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1949	10.358
				10.350
56	UTI - Fixed Term Income Fund Series XXXI-IX (1168 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1864	
57	UTI - Fixed Term Income Fund Series XXXI-IX (1168 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1772	10.59
58	UTI - Fixed Term Income Fund Series XXXI-X (1168 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1977	10.41
59	UTI - Fixed Term Income Fund Series XXXI-X (1168 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1913	10.40
60	UTI - Fixed Term Income Fund Series XXXI-XI (1169 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1944	10.23
61	UTI - Fixed Term Income Fund Series XXXI-XI (1169 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1879	10.228
62	UTI - Fixed Term Income Fund Series XXXI-XII (1148 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1774	10.66
63	UTI - Fixed Term Income Fund Series XXXI-XII (1148 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1753	10.57
64	UTI - Fixed Term Income Fund Series XXXI-XIII (1127 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1793	10.568
65	UTI - Fixed Term Income Fund Series XXXI-XIII (1127 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1701	10.55
66	UTI - Fixed Term Income Fund Series XXXI-XIV (1111 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1773	10.55
67	UTI - Fixed Term Income Fund Series XXXI-XIV (1111 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1682	10.545
68	UTI - Fixed Term Income Fund Series XXXI-XV (1099 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1726	10.470
69	UTI - Fixed Term Income Fund Series XXXI-XV (1099 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1632	10.45
70	UTI - Fixed Term Income Fund Series XXXII-I(1126 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1769	10.510
71	UTI - Fixed Term Income Fund Series XXXII-I(1126 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1678	10.500
72	UTI - Fixed Term Income Fund Series XXXII-II(1111 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1771	10.56
73	UTI - Fixed Term Income Fund Series XXXII-II(1111 Days)	Regular Plan - Quarterly Payout of IDCW option	0.1679	10.55
74	UTI - Fixed Term Income Fund Series XXXIII-I (1135 Days)	Direct Plan - Quarterly Payout of IDCW option	0.1754	10.45

Face Value per unit in all the above schemes/plans is ₹ 10. Record date for all the above mentioned schemes/plans will be **Monday**, September 13, 2021. Distribution of above dividend is subject to the availability of distributable surplus as on record date. Income distribution cum capital withdrawal payment to the investor will be lower to the extent of statutory levy (if applicable). Pursuant to payment of dividend, the NAV of the income distribution cum capital withdrawal options of the schemes would fall to the extent of payout and statutory levy (if applicable).

Such of the unitholders under the income distribution cum capital withdrawal option whose names appear in the register of unitholders as at the close of business hours on the record date fixed for each income distribution cum capital withdrawal distribution shall be entitled to receive the income distribution cum capital withdrawal so distributed. The reinvestment, if any, shall be treated as constructive payment of income distribution cum capital withdrawal to the unitholders as also constructive receipt of payment of the amount by the unitholders. No load will be charged on units allotted on reinvestment of income distribution cum capital withdrawal.

Mumbai - September 07, 2021

Toll Free No.: 1800 266 1230

REGISTERED OFFICE: UTI Tower, 'Gn' Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400051. Phone: 022 - 66786666. UTI Asset Management =

Website: www.utimf.com

Company Ltd. (Investment Manager for UTI Mutual Fund) E-mail: invest@uti.co.in, [CIN-L65991MH2002PLC137867]. For more information, please contact the nearest UTI Financial Centre or your AMFI/ NISM certified Mutual fund distributor, for a copy of Statement of Additional Information, Scheme Information Document and Key Information Memorandum cum Application Form.

Mutual Fund Investments are subject to market risks, read all scheme related documents carefully.

financialexp.epap

Date: September 7, 2021

(CIN: U24232GJ1996PLC029894) Registered Office: Plot No. 502/17 GIDC Estate, Ankleshwar,

Email: cs@tatvachintan.com, Website: www.tatvachintan.com

NOTICE is hereby given that the 25" Annual General Meeting("AGM") of Tatva

Companies (Management and Administration) Rules 2015 as amended and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 as amended from time to time, the following information is available to members of the Company:

b) The remote e-voting shall commence on 26 September 2021 at 9:00 a.m.

 The remote e-voting shall close on 28 September, 2021 at 5:00 p.m. (IST); and/or e-voting during the AGM shall be 22 September 2021.

f) Members may note that:

technical issues related to login through Depository i.e. NSDL/ CDSL, they may Lonin Time Holadack dataile

022-23058738 or 22-23058542-43. Helpdesk for Individual Shareholders holding securities in physical mode/ Institutional shareholders & evoting service provider is LINK INTIME.

https://instavote.linkintime.co.in, under Help section or send an email to enotices@linkintime.co.in or contact on: - Tel: 022 - 4918 6000. Notice is also hereby given that pursuant to the provisions of Section 91 (1) of the

By Order of Board For Tatva Chintan Pharma Chem Limited Date: 06.09.2021 Place: Vadodara

Place: Mumbai

सरडारी शाणाना शिक्षडोनी ८ डलाडनी इर४ जिया पडशे : शिक्ष शमंत्री युडा सभा

પ્રતિનિધિ) અમદાવાદ,તા.૭ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ શિક્ષકોને શાળામાં આઠ કલાક ફરજ બજાવવાનો નિયમ કરવામાં આવ્યો છે. તેથી રાજ્યના શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સરકાર સામે શાળામાં શિક્ષકોનો સમય પહેલાની જેમ યથાવત કરવા માટે રજૂઆત કરી હતી. પણ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની માગણીને ફગાવવામાં આવી છે. જેથી શાળામાં શિક્ષકોએ ૮ કલાક ફરજ બજાવવી પડશે. શિક્ષકો પણ સરકારી કર્મચારી છે અને બીજા સરકારી કર્મચારીઓ ૮ કલાક નોકરી કરે છે, तेवं निवेदन राज्यना शिक्षणमंत्री ભ્પેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા આપવામાં આવ્યું છે.

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકારના બધા કર્મચારીઓ ૮ કલાક કામ કરતા હોય ત્યારે શિક્ષકો પણ રાજ્ય સરકારના

કર્મચારી જ છે. એટલે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ શાળામાં ૮ કલાક આવવું જોઈએ. સાથે જ તેમને ધોરણ ૧થી ૫ની શાળા શરૂ કરવા બાબતે જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થી અને તેના સ્વાસ્થ્યના હિતમાં નિર્ણય કરીએ છીએ. પહેલા કોલેજ, પછી ૯, ૧૦, ૧૧, ૧૨ પછી ૨ તારીખથી ૬થી ૮ અને હવેનો નિર્ણય નાના બાળકોને સ્પર્શે છે. એટલે તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે પ્રમાણે યોગ્ય સમયે આ બાબતે નિર્ણય કરીશું.

મહત્વનું છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા જ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, શિક્ષકોએ શાળામાં ૬ કલાકની જગ્યા પર ૮ કલાકનો સમય આપવો પડશે. સરકારના આ નિર્ણય અનુસાર શિક્ષકોને શાળામાં સવારે ૧૦થી સાંજને ૬ વાગ્યા સુધી હાજર રહેવું પડશે. શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટ્ એજ્યુકેશન એક્ટની જોગવાઈ અનુસાર શિક્ષકોને ૬ કલાકની જગ્યા પર ૮ કલાક હાજર રહેવાની જોગવાઈ કરવામાં આવી હતી. આરટીઇ એક્ટની જોગવાઈ અનુસાર રાજ્યના શિક્ષકોએ હવે એક અઠવાડિયામાં શાળામાં ૪૫ કલાક હાજરી આપવી પડશે.

સોમથી શુક્રવાર સુધી શાળામાં શિક્ષકોએ ૮ કલાકની કામગીરી કરવાની રહેશે. શનિવારના રોજ શિક્ષકોએ ૫ કલાકની કામગીરી કરવાની રહેશે. પણ રાજ્યના શિક્ષકો આ નિર્ણયને માનવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ જ્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષક સક્ક્તા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું તે સમયે પણ રાજ્યના મોટાભાગના શિક્ષકોએ આ સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે કેટલાક શિક્ષકોના મત અનુસાર શિક્ષકોની સાથે બદલો લેવા માટે શિક્ષણ વિભાગે શિક્ષકોને ૮ કલાકની નોકરી કરવાનો આદેશ આરટીઇના નામે કર્યો હોઈ શકે છે.

અંબાજીમાં વરસાદે ધમાકેદાર

બેટિંગ કરી હોવાથી અંબાજીના માર્ગો

પાણીમાં ગરકાવ થઈ ગયા

હતા..ભક્તોની અવરજવર વચ્ચે

અચાનક વરસાદ શરૂ થતા શ્રદ્ધાળુંઓને

હાલાકી ભોગવવાનો વારો આવ્યો

હતો..ઉક્ષેખનીય છે કે, મહામેળો શરૂ

થતા પહેલા જ મોટી સંખ્યામાં લોકો

અંબાજી તરફ પગપાળા જઈ રહ્યાં છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી બે દિવસ ભારે વરસાદ પડશે અમદાવાદ શહેરમા

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૭ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ૮ અને ૯ સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જયારે દરિયા કિનારાના જિલ્લામાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે ૮ સપ્ટેમ્બરે વસારી– વલસાડ– ખેડા– આણંદ– દાહોદ- વડોદરા- નર્મદા- ભરૂચ-સરત- ડાંગ- તાપી- અમરેલી-ભાવનગર- ગીર સોમનાથ-દીવ, ૯ સપ્ટેમ્બરે જુનાગઢ-ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ- રાજકોટ-વડોદરા- ભરૂચ- સુરત- નવસારી-ગાંધીનગર- અરવક્ષી- ખેડા-અમદાવાદ- આણંદ- પંચમહાલ-દાહોદ, ૧૦ સપ્ટેમ્બરે ગીર સોમનાથ– અમદાવાદ -આણંદ-પંચમહાલ-દાહોદ-છોટા ઉદેપુર- નર્મદા-સુરેન્દ્રનગર- જુનાગઢ- અમરેલી-બોટાદ- દીવ- અરવક્ષી-મહીસાગર- નવસારી-વલસાડમાં, જ્યારે ૧૧ સપ્ટેમ્બરે ગાંધીનગર-ખેડા– અમદાવાદ–સુરત–નવસારી– ગીર સોમનાથ-બોટાદ-દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫ કરોડને બન્ને કોઝ અપાચા

(પ્રતિનિધિ)અમદાવાદ, તા. ૭ કોરોના રસીકરણને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે કોરોના વેક્સિનેશનના પ્રથમ અને બીજા ડોઝમાં ગુજરાતે આજે ૭ સપ્ટેમ્બરના રોજ ૫ કરોડ ડોઝ આપવાની સિદ્ધિ

ગુજરાતના જ્યાં એક તરફ કોરોના સંક્રમણના આંકડા સતત ઘટી રહ્યા છે તો બીજી બાજુ સરકારે કોરોના રસીકરણની ઝડપ પણ વધારી દીધી છે. જેને પગલે ગુજરાત કોરોના વેક્સિનેશનમાં વધુને વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ગુજરાતમાં કરોડો લોકોએ કોરોના રસીકરણનો લાભ લીધો છે. ઉપરાંત નીતિન પટેલે નાગરિકો અને તબીબોને શુભેચ્છા પાઠવી હતી અને વેક્સિન મેળવનાર નાગરિકો અને કોરોના વોરિયર્સ ડોક્ટર્સ નર્સીસ અને અન્ય પેરામીડીકલ સ્ટાફને અભિનંદન આપ્યા

ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો સાથે આજે મેઘરાજાનું આગમન થયું હતું. શહેરના વસ્ત્રાલ, ઓઢવ, સીટીએમ, રબારી કોલોની ઉપરાંત એસ.જી.હાઇવે, બોપલ, ઘુમા, સેટેલાઇટ, વેજલપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે શહેરમાં મેઘરાજાનું આગમન થતા ભારે બફારા થી

શહેરીજનોને રાહત મળી છે.

બીજી તરફ, રાજ્યના અત્યાર

સુધી ૫૦ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. તેમજ રાજ્યના વિવિધ જીક્ષઓમાં વરસાદ વરસી રહ્યો છે. છેક્ષા ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે . જેના લીધે ડેમો અને નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. તેમજ વરસાદની ઘટ પણ ઘટી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ જિલ્લો, સુરત, મહીસાગર નવસારી પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. પંચમહાલના મોરવા હડફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા. સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ફરી મેઘરાજાની પધરામણી થઇ હતી. સુરતના અઠવાલાઇન્સ, રાંદર, અડાજણ, ઉધના તેમજ વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. લાંબા વિરામબાદ જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. સંતરામપુર, કડાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદી વાતાવરણથી મકાઈ,સુંઢીયું સહિત પાકમાં મોટી રાહત મળી હતી. મહીસાગર જિલ્લામાં વલાખથી પણ ઉપરાંત હેક્ટરમાં વાવેતરમાં રાહત થઇ હતી. નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રોડ રસ્તા અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા.કાળા ડિબાંગ વાદળો સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.વરસાદી માહોલથી

બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ વરસાદ વરસ્યો. પ્રાંતિજ તેમજ અમીનપુર અને કમાલપુર સહિતના પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે ડાંગર તેમજ મગફળીના પાકને જીવતદાન મળ્યું છે.

ડાંગર,, શેરડી અને શાકભાજી સહિતના

પાકોને રાહત મળી હતી.

हवे गुજरातमां धो. १थी पना ओइलार्धन वर्गो शरू डरवानी तैयारी, शिक्षणप्रधाने आप्यो संडेत (પ્રતિનિધિ) અમદાવાદ, તા.૭ પહેલાં કોલેજ બાદમાં ધોરણ ૧૦થી ૧૨ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતાં

રાજ્યમાં કોરોનાના કેસો ઘટી ગયા છે. ફરીથી જિંદગી પૂર્વવત થઈ રહી છે. ત્યારે હવે ધોરણ ૧ થી પના ઓફલાઇન વર્ગો શરૂ કરવા પર રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે સંકેત આપ્યો છે. કેવડીયા ખાતે શુરપાણેશુર મહાદેવની પૂજા દરમિયાનમાં જણાવ્યું કે, 'કોર કમિટી અને આરોગ્ય વિભાગની બેઠક તેમજ શિક્ષણવિદોની સલાહ બાદ અમે યોગ્ય નિર્ણય કરીશું.

તેમજ ગત અઠવાડીયામાં ધોરણ ૬, ૭ અને ૮ના વર્ગો ખોલવામાં પણ સફળ રહ્યાં છીએ. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી રહ્યાં છે તો બીજી તરફ શિક્ષકો પણ ઉત્સાહથી ભણાવી રહ્યાં છે. ત્યારે આગામી તબક્કામાં કોર કમિટીમાં ધોરણ વથી પના વર્ગો શરૂ કરવા અંગે વિચાર કરીશું. એ '

માટે આરોગ્ય અને શિક્ષણવિદોની સલાહ પણ

અત્રે ઉક્ષેખનીય છે કે, રાજ્યમાં ધોરણ ૬થી ૮ના વર્ગો તો ૨જી સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેમાં ૫૦ ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તદ્દપરાંત ધોરણ ૯થી ૧૨ના વર્ગો પણ શરૂ છે. જો કે, શાળામાં

મુખ્ય પ્રધાન અને નીતિ આયોગના ચેરમેન વચ્ચે

ફલેગશિપ પ્રોગ્રામ- વિકાસ કાર્ચોની સિદ્ધિઓ અને કોવિક અંગેની ચર્ચા

(પ્રતિનિધિ)અમદાવાદ, તા. ૭ નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવકુમારે ગુજરાતની પોતાની મુલાકાત દરમિયાન મંગળવારે સવારે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ તેમજ વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બેઠકમાં નીતિ આયોગના વાઇસ ચેરમેનને રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, મુખ્યપ્રધાન ગ્રામ સડક

માણેજાના ખુશાલભાઈ પંચાભાઈ મકવાણા ગુમ થયા

વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં મકાન નં. ૩૬ વિકુલ નગરમાં રહેતા ખુશાલભાઈ પંચાભાઈ મકવાણા ઉંમર વર્ષ ૬૩ તા. ૨૫.૦૮.૨૦૨૧ ના રોજ પોતાના ઘરેથી સવારે કોઈને કશું જાણ કર્યા વગર પીધેલ હાલતમાં જતા રહ્યા છે. ત્યાર બાદ આજદિન સુધી પરત મળી આવેલ નથી

યોજના, મેટ્રો રેલ પ્રોજેક્ટ,સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાણી પુરવઠા,ડિજિટલ સેવા સેત્ સહિતના ક્ષેત્રમાં વિકાસ કાર્યોની સિદ્ધિઓ અને કોવિડ મહામારી દરમિયાનની સઘન આરોગ્યલક્ષી કામગીરીને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની વિગતોથી માહિતગાર કર્યા હતા.

નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવકુમારે ગુજરાત સરકારની કૃષિ, ઉર્જા, ગ્રામિણ વિકાસ, જળ વ્યવસ્થાપન અને સિંચાઇ યોજનાઓના અસરકારક અમલીકરણથી સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતે એફ.ડી.આઇમાં જે અનન્ય સિદ્ધિ મેળવી છે તેની તુલના હવે વિશ્વના વિકસિત દેશોના પ્રદેશો સાથે થવી જોઈએ.રાજીવકમારે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને સ્થિત સી.એમ. ડેશબોર્ડથી થતી ડીજીટલ ગવર્નનસની કામગીરી અને રાજ્ય સરકારના તમામ વિભાગોની કામગીરીનું રિયલ ટાઈમ મોનીટરીંગ, રાજ્ય સરકાર દ્વારા ધોલેરા જાંઈએ સિંગાપોરથી મોટુ સ્માર્ટ સિટી બનાવવા માટેના આયોજન અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી-ગિફ્ટ સિટીની સરાહના કરી

શાળામાં ફરજિયાત માસ્ક અને વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સનં પાલન કરવાનો આદેશ અપાયો છે તેમજ સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની

ત્યારે હવે રાજ્ય સરકારે ધોરણ ૧થી પની પ્રાથમિક શાળા શરૂ કરવા અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું છે.

Shaily Engineering Plastics Limited SHAILY

CIN: L51900GJ1980PLC065554

Regd. Office: Survey # 364/366, Post: Rania - 391 780, Taluka: Savli, Dist. Vadodara Phone No.: 02667 - 244307/361 | Fax No.: 02667-244372 E-mail: investors@shaily.com | Visit us: www.shaily.com

Corrigendum to Notice of the 41st Annual General Meeting of the Company

Notice is hereby given that Shaily Engineering Plastics Limited ("the Company") had issued Notice dated 17th August, 2021 ("AGM Notice") for convening the 41th Annual General Meeting ("AGM") of the shareholders, scheduled to be held on Tuesday, 14th September, 2021, through Video Conferencing ("VC") or other Audio-Visual Means ("OAVM"). The AGM Notice has already been circulated to all the Shareholders of the Company in due compliance with the provisions of the Companies Act, 2013 and read with the Rules made thereunder.

This corrigendum should be read in conjunction with the AGM Notice, details are as follows:

- In Item No. 7, for Preferential issue of shares of the Company, under the table appearing at Page No. 5 of the AGM Notice, whereunder the list of allottees have been mentioned, for the particulars of Investor - Light House India Fund III, Limited, the category of the Investor will be read as "Foreign Bodies Corporate (Non-Promoter)" instead of "Foreign Portfolio Investor (Non-Promoter)".
- Accordingly, in Explanatory Statement for Item No. 7 of the AGM Notice for Preferential issue of shares of the Company, at point no. (C) and (J) in the table containing the list of allottees at Page No. 14 and 15 of the AGM Notice respectively, for particulars of Investor - Light House India Fund III Limited, the category of the Investor will be read as "Foreign Bodies Corporate (Non-Promoter)" instead of "Foreign Portfolio Investor (Non-Promoter)"
- In the Explanatory Statement for Item No. 7, at point no. (K) under the Shareholding Pattern of the Company before and after the Preferential Issue of Equity shares, shareholding details of Light House India Fund III, Limited will accordingly be shifted from the category of - "Foreign Portfolio Investors" to "Bodies Corporate" under the heading of Public Shareholder.

Other contents of the AGM Notice remain unchanged. This Corrigendum shall form an integral part of the AGM Notice circulated to the shareholders of the Company. Accordingly, all concerned shareholders, Stock Exchange, Depositories, Registrar and Share Transfer Agent, agencies appointed for e-voting, other Authorities, regulators and all other concerned persons are requested to take note of

This Corrigendum shall also be available at the website of the Company at www.shaily.com at weblink https://www.shaily.com/investors/annual-report and on the website of BSE Limited at

For Shaily Engineering Plastics Limited

Vadodara September 07, 2021

Mahendra Sanghvi **Executive Chairman**



તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડ

(CIN: U24232GJ1996PLC02984) રજીસ્ટર્ડ કચેરી : પ્લોટ નં. ૫૦૨/૧૭ જીઆઇડીસી એસ્ટેટ, અંકલેશ્વર, ભરૂચ જીજે ૩૯૩૦૦૨ ફોનઃ +૯૧૭૫૪૮૪૮૫૩૩/૩૪, ફેક્સ : +૯૧૨૬૫૨૬૩૮૫૩૩ ઇમેઇલ:cs@tatvachintan.com, વેબસાઇટ :www.tatvachintan.com

વીડિયો કોન્કરન્સ ("VC")/ અન્ય ઓડિયો વિઝ્યુઅલ અર્થ "OAVM") અને ઇ–વોટિંગ માહિતી દ્વારા ૨૫ ''વાર્ષિક સામાન્ય બેઠક (AGM) ને લગતી જાહેર સૂચના

આથી સુચના આપવામાં આવે છે કે તત્વા ચિંતન ફાર્મા કેમ લિમિટેડ (''કંપની'') ની ૨૫ મી વાર્ષિક મામાન્ય સભા (''એજીએમ'') ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ ને બુધવારે સાંજે ૪:૦૦ કલાકે યોજાશે. (IST) વિડીયો કોન્ફરન્સ ("VC")/ અન્ય ઓડિયો વિઝ્યુઅલ મીન્સ ("OAVM") દ્વારા કોર્પોરેટ ષાબતોના મંત્રાલય (''એમસીએ'') દ્વારા જારી કરાયેલા અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ત્યારબાદ સામૃહિક રીતે) દ્વારા જારી કરાયેલા તમામ પરિપત્રોનું પાલન કરે છે. પરિપત્ર તરીકે ઓળખાય છે).

કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ ની દ્રષ્ટિએ કંપનીઓ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૫ ના સુંધારેલા અને SEBI (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમ ૨૦ સાથે વાંચવામાં આવે છે, જે સમય સમય પર સુધારેલ છે, નીચેની માહિતી પનીના સભ્યો માટે ઉપલબ્ધ છે:

લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટની ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ મારફતે ૨૫ મી એજીએમની નોટિસમાં જણાવ્યા મજબ કર ઓક તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ઇક્વિટી શેર ધરાવતાં સભ્યો ભૌતિક સ્વરૂપમાં અથવા ડિમેટીલાઇઝ્ડ કોર્મમાં ઇલેક્ટોનિક રીતે પોતાનો મત આપી શકે છે. મર્યાદિત https: /instavote.linkintinne.co.in (રિમોટ ઈ-વોટિંગ સુવિધા પૂરી પાડવા માટે નિયુક્ત એજન્સી) તમામ સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે:

a) ૨૫ મી AGM ની નોટિસમાં દર્શાવ્યા મુજ ઈ-વોટિંગ દ્વારા કરવામાં આવશે;

b) રિમોટ ઈ-વોટિંગ ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે શરૂ થશે (IST);

c) રિમોટ ઈ-વોટિંગ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે બંધ થશે. (IST); d) AGM દરમિયાન રિમોટ ઇ-વોર્ટિંગ અને/અથવા ઇ-વોર્ટિંગ દ્વારા મત આપવાની પાત્રતા નક્કી કરવાની કટ ઓફ તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ હશે.

e) કોઈપણ વ્યક્તિ, જે કંપનીના ઇક્વિટી શેર મેળવે છે અને AGM ની નોટિસ મોકલ્યા પછી કંપનીના સભ્ય બને છે. તે નોંધ નં. AGM ની નોટિસ ૨૫. f) સભ્યો નોંધ કરી શકે છે કે:

. રિમોટ ઇ-વોટિંગ સાંજે ૫:૦૦ વાગ્યાથી અક્ષમ કરવામાં આવશે. (IST) ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ અને એકવાર ઠરાવ પર મત પડ્યો અને સભ્ય દ્વારા પુષ્ટિ કરવામાં આવી તો તેને પછીથી તેને બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં;

. એજીએમ દરમિયાન ઇ-વોટિંગ માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે અને એસીએમમાં વીસી/ ઓએવીએમ સૃવિધા મારફતે હાજર રહેલા સભ્યો, જેમણે રિમોટ ઇ-વોટિંગ દ્વારા રિઝોલ્યશન પર પોતાનો મત આપ્યો નથી અને અન્યથા તેમ કરવાથી રોકવામાં આવશે નહીં. એજીએમમાં ઇ-વોટિંગ સિસ્ટમ દ્વારા મત આપવા માટે લાયક બનો. એજીએમ દરમિયાન મતદાન માટેની વિગતવાર પ્રક્રિયા નોટ નંબર પર નોટિસમાં નિર્ધારિત કરવામાં આવી છે. સૂચનાનો ૨૫ નો ભાગ.

II. જે સભ્યોએ એજીએમ પહેલા રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે તેઓ પણ વીસી દ્વારા એજીએમમાં જોડાઈ શકે છે પરંતુ ફરીથી મત આપવા માટે હકદાર રહેશે નહીં;

IV. એક વ્યક્તિ, જેનું નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઓ દ્વારા જાળવવામાં આવતા લાભાર્થી માલિકોના રજિસ્ટરમાં કટ-ંઓફ તારીખ એટલે કે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ નોંધાયેલું હોય તે માત્ર રિમોટ ઇ-વોટિંગ દ્વારા અથવા તેના દ્વારા મત આપવા માટે હકદાર રહેશે. AGM માં ઈ-વોટિંગ;

V. સભ્યો નોંધ કરી શકે છે કે આ નોટિસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.tatvachintan.com, સ્ટોક એક્સચેન્જોની વેબસાઇટ એટલે કે BSE લિમિટેડ ("BSE"") અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ ("NSE") પર ઉપલબ્ધ છે. www.bseindia.com અને www.nseindia.com અનુક્રમે

અને Link Intime India Private Limited ની વેબસાઇટ પર https://linkintime.co.in એજીએમ દરમિયાન રિમોટ ઇ-વોટિંગ કરવા માટે નિયુક્ત એજન્સી.

VI. ઇલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન માટેની સુવિધા સાથે જોડાયેલી તમામ ફરિયાદો શ્રી રાજીવ રંજન (AVP) ને સંબોધવામાં આવી શકે છે, લિંકનો સમય અથવા enotice@linkintime.co.in પર ઇમેઇલ મોકલી શકાય છે. અથવા rnt@linkintime.co.in અથવા ટેલ પર કલ કરો: ૦૨૨–૪૯૧૮૬૦૦૦. ડીમેટ મોડમાં સિક્યોરિટીઝ ધરાવતા વ્યક્તિગત શેરધારકો માટે હેલ્પડેસ્ક:

ડિમેટ મોડમાં સિક્યોરિટીઝ ધરાવતા શેરહોલ્ડરો/ સભ્યોને ડિપોઝિટરી એટલે કે NSDL/ CDSL મારફતે લોગિન સંબંધિત કોઈ તકનીકી સમસ્યા હોય તો, તેઓ નીચે આપેલા સંબંધિત હેલ્પડેસ્કનો સંપર્ક કરી

9:	
લોગિન પ્રકાર	હેલ્પડે સ્કની વિગતો
યક્તિગત શેરધારકો મેનએસડીએલ સાથે ડીમેટ મોડમાં સેક્યોરિટી ધરાવે છે	લોગિનમાં કોઈપણ તકનીકી સમસ્યાનો સામનો કરતા સભ્યો evoting@nsdl.co.in પર વિનંતી મોકલીને ગર્જીક હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકે છે અથવા ટોલ ફ્રી નંબર પર ક લ કરી શકે છે: ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦
ાકિતગત શેરધારકો સીડીએસએલ ાથે ડીમેટ મોડમાં સિક્યોરિટી ધરાવે	સભ્યો કોઈપણ તકનીકી સમસ્યાનો સામનો કરી રહ્યા છે લોગિન helodesk.evoting@cdslindia.com પર વિનંતી મોકલીને CDSL હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકે છે અથવા ૦૨૨-૨૦૫૮७૩૮ અથવા ૨૨-૨૩૦૫૮૫૪૨-૪૩ પર સંપર્ક કરી શકે છે.
ડેએક માટે વ્યક્તિગત શેરધારકો હ	

અને ઈ-વોટિંગ સેવા પ્રદાતા લિંક સમય માં છે

જો શારીરિક સ્થિતિ / સંસ્થાકીય શેરધારકોમાં સિક્યોરિટીઝ ધરાવતા શેરહોલ્ડરો / સભ્યોને ઈ-વોટિંગ સંબંધિત કોઈ પ્રશ્નો હોય, તો તેઓ વારંવાર પૂછાતા પ્રશ્નો (""FAQs"") અને ઇન્સ્ટાનો સંદર્ભ લઈ શકે છે. વોટ ઇ –વોર્ટિંગ મેન્યુઅલ https://instavote.linkintime.co.in પર ઉપલબ્ધ છે, સહાય વિભાગ હેઠળ અથવા enotices@linkintime.co.in પર ઇમેઇલ મોકલો અથવા સંપર્ક કરો: - ટેલી: ૦૨૨ -

કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૯૧ (૧) અને સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના સેક્શન ૯૧ (૧) ની જોગવાઈઓને અનુલક્ષીને આથી નોટિસ પણ આપવામાં આવી છે, સભ્યોનું રજિસ્ટર અને કંપનીની ટ્રાન્સફર બુક્સ શેર્ર કરો ૨૫ મી AGM ના હેતુ માટે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ (બંને દિવસો સહિત) બંધ રહેશે.

બોર્ડના આદેશથી વતી. તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડ અપૂર્વા દુખે કંપની સેક્રેટરી એન્ડ કોમ્પ્લાયન્સ ઓફિસર

તારીખ : ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૧

ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેક

રજીસ્ટર્ડ ઓફિસ ઃ સર્વે નં. ૧૬/૩, ૨૬ અને ૨७, ગામ : રણજીતનગર - ૩૮૯ ૩૮૦ તાલુકો : ઘોઘંબા, જીલ્લો : પંચમહાલ, ગુજરાત. ટેલિફોન : (૯૧ ૨૬७८) ૨૪૭૨૨૦ ફેક્સ : (૯૧ ૨૬७८) ૨૪૭૨૨૦ **ઇમેઇલ :** bydesai@gfl.co.in **વેબસાઇટ :** www.gfl.co.in

વીડિયો કોન્ફરન્સિંગ / અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમો મારફતે ચોજાનાર 3**૭** વાર્ષિક સામાન્ય સભા ("એજીએમ") સંબંધિત માહિતી

આથી **નોટિસ** આપવામાં આવે છે કે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ ("કંપની") ના સભ્યોર્ન 39 એજીએમ તેની નોટિસમાં નિઘરિલ વ્યવસાયોના વ્યવहાર માટે ગુરૂવાર, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૩૦ વાગે વીડિયો કોન્ફરન્સિંગ (વીસી) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (ઓએવીએમ) મારફતે ચોજવામાં આવનાર છે.

કોવિડ-૧૯ ને કારણે થયેલ મહામારી વધતી જવાને કારણે, કોર્પોરેટ બાબતોના મંત્રાલર ("એમસીએ") એ તા. ૮મી એપ્રિલ, ૨૦૨૦ અને તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ ના સામાન્ય પરિપત્રોના વંચાણની સાથે તેના તા. પમી મે, ૨૦૨૦ ના સામાન્ય પરિપત્ર અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયાએ તેના તા. ૧૨મી મે, ૨૦૨૦ અને તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨ ના પરિપત્રો (" સેબી પરિપત્ર ") મારફતે એક સામાન્ય સ્થળે સભ્યોની ભૌતિક હાજરૌ વિના વીસી ્ ઓએવીએમ મારફતે એજીએમનું આયોજન કરવાની મંજૂરી આપેલ છે. તા. ૧૩મી જાન્યુઆરી ૨૦૨૧ ના એમસીએ પરિપત્ર દ્વારા એ કંપનીઓને તેના તા. પત્ની મે, ૨૦૨૦ ના પરિપત્રમાં આપવામાં આવેલ જરૂરિયાત અનુસાર વીસી/ઓએવીએમ માધ્યમ મારફતે તેમની એજીએમ ડિસેમ્બર ૩૧, ૨૦૨૧ ના રોજ કે તેના પહેલાં યોજવાની મંજૂરી આપેલ છે, જે કંપનીઓની એજીએમ વર્ષ ૨૦૨૦ માં યોજાવાની હતી અથવા વર્ષ ૨૦૨૧ માં યોજાવામાં આવનાર હતી.

એમસીએ પરિપત્રો અને સેબી પરિપત્રના અનુપાલનમાં, એજીએમની નોટિસ અને વર્ષ ૨૦૨૦-૨૧ માટેના વાર્ષિક અદેવાલને કંપનીના એ તમામ સભ્યોને ફક્ત ઈલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામ આવેલ છે, જેઓના ઇમેઈલ આઈડી કંપની / ડિપોઝીટરી ભાગીદાર (રો) પાસે નોંધાચેલા છે. ૩જ એજીએમની નોટિસ અને વર્ષ ૨૦૨૦-૨૧ માટેના વાર્ષિક અદેવાલને કંપનીની વેબસાઇટ www.gfl.co.in પર "ઈન્વેસ્ટર રિલેશન્સ" વિભાગ હેઠળ અને કંપનીના શેર જ્યાં લિસ્ટેક છે તે શેર બજારો એટલે કે બીએસઈ લિમિટેકની વેબસાઈટ https://www.bseindia.com તથા નેશનલ સ્ટॉક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડની વેબસાઈટ <u>https://www.nseindia.com</u> તથા સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડ ("સીડીએસએલ")ની વેબસાઈટ www.evotingindia.com ઉપર પણ અપલોક કરવામાં આવેલ છે.

સભ્યો ફક્ત વીસી / ઓએવીએમ સુવિધા મારફતે જે એજીએમમાં હાજર રહીને ભાગ લઈ શકશે. એજીએમમાં જોડાવા માટેના નિર્દેશો એજીએમની નોટિસમાં પ્રદાન કરવામાં આવેલ છે. વીસી , ઓએવીએમ સુવિધા મારફતે ભાગ લઈ રહેલ સભ્યોને અધિનિયમના સેક્શન ૧૦૩ હેઠળ કોરમના હેતુ માટે ગણવામાં આવશે. સભ્યો દ્વારા પ્રોક્સીઓની નિયુક્તિ માટેની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં કારણકે એજીએમ વીસી / ઓએવીએમ દ્વારા યોજવામાં આવી રહી છે.

નોટિસ અને વાર્ષિક અદેવાલ મેળવવા માટે, સભ્યોને તેમના ઈ-મેલ એડ્સેને તેમના ડિપોઝીટર્ર ભાગીદાર (રો) પાસે નોંધાવવા/અપકેટ કરાવવાની વિનંતી કરવામાં આવે છે, જો તેઓએ પહેલેથી નોંધાવેલ/અપડેટ કરાવેલ નથી. જે સભ્યો ભૌતિક રૂપે શેર ધરાવે છે તેઓ કંપનીના રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ; લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ("લિન્ક ઈનટાઈમ") ની વેબસાઈટ nttps://www.linkintime.co.in/EmailReg/Email_Register.html પર જઇને તેમાં જણાવેલ આવશ્ચક દસ્તાવજો અપલોડ કરી શકે છે.

કંપની તેના તમામ સભ્યોને એજીએમની નોટિસમાં નિર્ધારિત તમામ દરાવોના સંબંધમાં સીડીએસએલના ઈ-વોટિંગ પ્લેટફોર્મ મારફતે રિમોટ ઈ-વોટિંગ સુવિધા પ્રદાન કરી રહી છે. વધુમાં કંપની એજીએમ દરમિયાન ઈ-વોટિંગ પ્રણાલી મારફતે મત આપવાની સુવિધા પ્રદાન કરી રહી છે. ઈ-વોટિંગ મારકતે મત આપવા માટે લોગઈન ક્રેડેન્શિયલ્સ સભ્યોના નોંધાયેલ ઈ-મેઈલ આઈડી પર મોકલવામાં આવશે. ઈ-વોટિંગ મારફતે મત આપવાની વિસ્તૃત પ્રક્રિયા પણ એજીએમની નોટિસમાં આપવામાં આવેલ છે. સભ્યોના મત આપવાના અધિકારો ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ (ઈ-વોટિંગ માટેની કટ-ઑફ તારીખ) ના રોજ કંપનીની પેઈડ અપ શેર મૂડીમાં તેમના દ્વારા ઘારિત ઈક્વિટી શેરોન

રિમોટ ઈ-વોરિંગ અવધિ તા. ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ સવારે ૯.૦૦ વાગે શરૂ થાય છે અને તા. ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સાંજે ૫.૦૦ વાગે પૂર્ણ થાય છે સદર અવધિ દરમિયાન સભ્યો તેમન મત ઈલેક્ટ્રોનિકલી આપી શકે છે. ત્યારબાદ સીડીએસએલ દ્વારા રિમોટ ઈ-વોટિંગ મોડ્યૂલ અક્ષમ બનાવવામાં આવશે. જે સભ્યો વીસી / ઓએવીએમ સુવિધા મારફતે એ'એમમાં હાજર રહેશે અને ઈ-વોટિંગ મારફતે ઠરાવો પર પોતાના મત આપ્યા ન હતા તથા અન્યથા એવું કરવાથી અટકાવવામાં આવ્યા ન હતા, તેઓ એજીએમ દરમિયાન ઈ-વોટિંગ પ્રણાલી મારફત મત આપવાને પાત્ર બનશે.

કોઈપણ વ્યક્તિ નોટિસની રવાનગી પછી જે કંપનીના શેર સંપાદિત કરે છે અને કંપનીનો સભ્ય બને છે તથા કટ-ઑફ તારીખે શેર ધરાવે છે તેઓ helpdesk.evoting@cdsl.com ને એક વિનંતી મોકલીને લોગઈન આઈડી તથા પાસવર્ડ મેળવી શકે છે. જોકે, જો તે / તેણી પહેલેથી ઈ-વોટિંગ માટે સીડીએસએલ સાથે રજસ્ટર્ડ છે, તે/તેણી મત આપવા માટે તેના/તેના મૌજૂદા યૂઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે.

જે સભ્યો રિમોટ ઈ-વોટિંગ મારફતે પોતાના અધિકારનો ઉપયોગ કરે છે તેઓ પણ એજીએમમાં ભાગ લઈ શકે છે પરંતુ તેઓને એજીએમ ખાતે મત આપવાની મંજૂરી મળશે નહીં. જે વ્યક્તિનું નામ કટ-ઑફ તારીખના દિવસ એટલે કે ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં સભ્યોના ૨૭૨ટર અથવા કિપોઝીટરીઓ હ્રારા જાળવવામાં આવતા લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાચેલ છે, ફક્ત તેઓ જ રિમોટ ઈ વોટિંગની સુવિધાનો લાભ લેવા અથવા એજીએમમાં મત આપવાને હકદાર બનશે.

જો આપને એજીએમમાં ઠાજરી આપવા અને સીડીએસએલ ઈ-વોટિંગ પાગાલી પરથી ઈ-વોટિંગ સાથે જોડાયેલ કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ છે, તો આપ helpdesk.evoting@cdslindia.com ને ઈમેલ લખી શકો છો અથવા ૦૨૨- ૨૩૦૫૮૭૩૮ તથા ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩ પર સંપર્ક કર્ટ શકો છો. ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મતદાન માટેની સુવિધા સાથે જોડાયેલ તમામ ફરિયાદો શ્રી. રાકેશ દળવી, સિની. મેનેજર, (સીડીએસએલ), સેન્ટ્રલ કિપોઝિટરી સર્વિસિસ (ઈન્કિયા) લિમેટેક, એ વિન્ગ, ૨૫ મો માળ, મેરાથોન ફ્યુચરેક્સ, મફતલાલ મિલ પરિસર, એન એમ જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઇ - ૪૦૦૦૧૩ ને મોકલી શકાય છે અથવ helpdesk.evoting@cdslindia.com પર ઇમેલ મોકલી શકાય છે અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩૫૨કૉલકરી શકાય છે.

બોર્ડ ઑફ ડિરેક્ટર્સના આદેશ દ્વારા, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેક વર્તી

ભાવિન દેસાઇ કંપની સેક્રેટરી

સ્થળ : વડોદરા **તારીખ :** ૮મી સપ્ટેમ્બર, ૨૦૨૧

("AGM") through VC / OAVM, without the physical presence of the Members at a common venue. In compliance with the MCA Circulars and the relevant provisions of the Companies Act, 2013 and SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, the AGM

of the members of the Company will be held through VC / OAVM. In terms of MCA Circulars and SEBI Circular, the Notice of 29th AGM and the Annual Report for the financial year 2020-21 has been sent to hose Members whose email addresses are registered with the Company Depository Participants. The requirements of sending physical copy of the Notice and 29th AGM and Annual Report to the Members have been dispensed with vide MCA Circular and SEBI Circular

Samrat Pharmachem Limited

Tel: (02646) 220774 Fax: (02646) 251291

Andheri (West), Mumbai - 400 058. India.

Corporate Office 701/702 Business Square, M.

Web: www.samratpharmachem.com

Email: contact@samratpharmachem.ir

CIN:L24230GJ1992PLC017820

NOTICE OF 29th ANNUAL GENERAL MEETING.

BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the Twenty-Ninth Annual General Meeting of

2021 at 1.00 p.m. through Video Conferencing ("VC") / Other Audio

Visual Means ("OAVM"), to transact the business, as set out in the Notice

In view of the continuing COVID-19 pandemic, the Ministry of Corporate

ead with 14/2020, 17/2020 and 02/2021 dated April 8, 2020, April 13,

2020 and January 13, 2021 respectively (collectively referred to as

"MCA Circulars") permitted the holding of the Annual General Meeting

fairs ("MCA") has vide its circular nos. 20/2020 dated May 5

the Members of the Company will be held on Thursday, 30th Septe

of the AGM which is being circulated for convening the AGM.

Regd. Office & Factory Plot No. A/2 3445, GIDC,

Tel: (91-22) 26701050/1/2 Fax: (91-22) 26701053

Phase 4, Opp. PCI, Ankleswar - 393 002, Gujarat, india

The Register of Members and the Share Transfer books of the Compar will remain closed from Thursday, September 23, 2021 to Thursday, September 30, 2021 (both days inclusive).

Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of September 23, 2021 may cast their vote electronically on the Ordinary Business, as set out in the Notice of 29th AGM through electronic voting system ("remote e-voting") of National Securities Depository Limited ("NSDL") All the members are informed that:

The Ordinary Business; as set out in the Notice of the 29th AGM, will

be transacted through voting by electronic means the remote e-voting shall commence on Monday, September 27 2021 at 9.00 a.m. IST and end on Wednesday, September 29, 2021

the cut-off date for determining the eligibility to vote through remote e-voting or through the e-voting system during the 29th AGM is Thursday, September 23, 2021;

any person who acquires shares of the Company and becomes member of the Company after sending Notice of the 29th AGM by email and holding shares as on the cut-off date i.e. September 23 2021, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or contact@samratpharmachem.in. However, i a person is already registered with NSDL for remote e-voting then existing user Id and password can be used for casting vote

The remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting

Members who have voted through Remote e-Voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the

The members participating in the 29th AGM and who had not cast their vote by remote e-voting, shall be entitled to cast their vote through e-voting system during the 29th AGM

The Notice of 29th AGM and the Annual Report are available on the website of the Company at www.samratpharmachem.com. The Notice can also be accessed from the website of the stock exchange i.e BSE Limited at www.bseindia.com and on the website of NSDL i.e www.evoting.nsdl.com In case of any gueries you may refer the Frequently Asked Question

(FAQs) for shareholders and e-voting user manual for shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request to Mr. Nipul Shah at evoting@nsdl.co.in Members holding shares in physical form, whose email addresses are not registered with the Company, may register their email address by sending Folio No., Name of the shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy

of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to contact@samratpharmachem.in. Members holding shares in electronic form shall update such details with their respective Depository Participant ("DP") For Samrat Pharmachem Limited

Nishant Kankaria Company Secretary & Compliance Officer Dated: September 6, 2021